

### NALIN LEASE FINANCE LTD.

CIN: L65910GJ1990PLCO14516

NLFL/201718/BSE793

Date: -January 20, 2018

To,
The Secretary,
Bombay Stock Exchange Ltd.,
25<sup>th</sup> Floor, Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Mumbai - 400 001.

Scrip Code: - 531212

Dear Sir,

Sub: - Submission of newspaper advertisement as per Regulation 47 of SEBI (Listing obligation and Disclosure Requirements) Regulations, 2015.

Pursuant to the provisions of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are enclosing herewith the copies of the newspaper advertisements published in both the English and Gujarati edition of Western Times regarding the publication of the unaudited financial results of the company for the financial year ended 31<sup>st</sup> December, 2017.

Kindly take the above information on your records.

Thanking you.

Yours Faithfully,

For, Nalin Lease Finance Limited

(N.K. Patel)

**Chief Financial Officer** 

Encl.: as above

### #6 **22 %** 8 स्योद्ध अपडेट

### બીજી વનડે : ઓસ્ટ્રેલિયા પર ઇંગ્લેન્ડનો ચાર વિકેટે વિજય

બ્રિસ્બેન ખાતે રમાયેલી બીજી ડેનાઇટ વનડેમાં ઓસ્ટ્રેલિયા ઉપર ઇંગ્લેન્ડે ચાર વિકેટે જીત મેળવી હતી. આની સાથે જ શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી હતી. ૩૪ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે ઇંગ્લેન્ડે આ મેચ જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત ૫૦ ઓવરમાં નવ વિકેટે ૨૭૦ રન કર્યા હતા જેમાં ફિન્ચે સતત બીજી સદી ફટકારી હતી. ફિન્ચ ૧૦૬ રન કરીને આઉટ થયો હતો જેમાં નવ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. જવાબમાં ઇંગ્લેન્ડ તરફથી ટોપ ઓર્ડરના બેટ્સમેનો ફરી છવાયેલા રહ્યા હતા. બેરશો ૬૦, હેલ્સ ૫૭ અને રુટ ૪૬ રન કરીને પોતાની ટીમને જીત અપાવવામાં ચાવીરુપ ભૂમિકા અદા કરવામાં સફળ રહ્યા છે કે નોટબંધી બાદ સામાન્ય રહ્યા હતા. ૧૪મી જાન્યુઆરીએ મેલબોર્ન ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયા ઉપર ઇંગ્લેન્ડે પાંચ વિકેટે જીત મેળવીને તમામ ક્રિકેટ ચાહર્કોને ચોંકાવી દીધા હતા. હાલમાં જ એસિઝ શ્રેણી ૪-૦થી ગુમાવી લીધા બાદ ઇંગ્લેન્ડની ટીમ જોરદાર દેખાવ સાથે વાપસી કરવામાં સફળ રહી હતી. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા આઠ વિકેટે ૩૦૪ રન કર્યા હતા જેના જેવાબમાં ઇંગ્લેન્ડે ૪૮.૫ ઓવરમાં ૩૦૮ રન માત્ર પાંચ વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ઇંગ્લેન્ડે તરફથી રોયે યાદગાર ઇનિંગ્સ રમતા ૧૫૧ બોલમાં ૧૬ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે ૧૮૦૨ન ફટકાર્યા હતા જ્યારે રુટે ૯૧ રન બનાવ્યા હતા. મેન ઓફ દ મેચ તરીકે રોયની પસંદગી કરાઈ હતી. હાલમાં ઘરઆંગણે એસિઝ શ્રેણીમાં ૪-૦થી જીત મેળવી લીધા બાદ ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણીમાં છવાશે

### अंतिम वनडे : न्युजीवेन्डनी પાકિસ્તાન ઉપર સરળ જીત

તેમ માનવામાં આવી રહ્યું છે પરંતુ પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે તેને

કારમીરીતે હાર આપી છે. હાલમાં પાંચમી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ

ઇનિંગ્સ અને ૧૨૩૨ને જીત મેળવીને એસીઝ શ્રેણી ૪-૦થી જીતી

લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે પેટ કમિન્સની પસંદગી કરાઈ

હતી જ્યારે મેન ઓફ દ સિરીઝ તરીકે સ્ટિવ સ્મિથની પસંદગી

વેલિગ્ટન ખાતે આજે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની પાંચમી અને અંતિમ વનડે મેચમાં પણ યજમાન ન્યુઝીલેન્ડે પાકિસ્તાન | પર ૧૫ રને જીત મેળવી હતી. આની સાથે જ ન્યુઝીલેન્ડે વન ડે 🔋 શ્રેણી પ-૦થી જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે પ૦ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને ૨૭૧ રન કર્યા હતા. જેમાં ઓપનિંગ બેટ્સમેન ગુપ્ટિલે સૌથી વધારે ૧૦૦ રન કર્યા હતા. ગુપ્ટિલ ૧૨૬ બોલમાં ૧૦ ચોગ્ગાની મદદથી આ રન બનાવવામાં સફળ રહ્યો **ી** હતો. ટેલરે અડધી સદી કરી હતી. જીતવા માટેના ૨૭૨ રનના 📘 લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાનની ટીમ ૨૫૬ રન કરીને ϳ ઓલઆઉટ થઇ ગઇ હતી. હરીશ સોહિલે સૌથી વધારે ૬૩ રન કર્યા હતા. આ મેચ અને સમગ્ર વનડે શ્રેણીમાં શાનદાર દેખાવ કરનાર ગુપ્ટિલની મેન ઓફ ધ મેચ અને સિરીઝ તરીકે પસંદગી કરવામાં આવી હતી. અગાઉ ૧૬મી જાન્યુઆરીના દિવસે રમાયેલી ચોથી 🗍 વનડે મેચમાં પણ ન્યુઝીલેન્ડે પાકિસ્તાન ઉપર ડેનાઇટ મેચમાં પાંચ | વિકેટે જીત મેળવી હતી. ૨૫ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે ચુઝીલેન્ડે જીત મેળવી લીધી હતી.તે પહેલવા ડ્યુનેડિન ખાતે રમાયેલી ત્રીજી વનડે મેચમાં ન્યુઝીલેન્ડે પાકિસ્તાન પર ૧૮૩ રને જીત મેળવી હતી. નેલ્સન ખાતે નવમી જાન્યુઆરીના દિવસે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની બીજી વનડે મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે પાકિસ્તાન પર ્ડકવર્થ લુઇસ્ પદ્ધિતીના આધાર પર આઠઁવિકેટે જીત મેળવી 🚪 હતી. વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે ટાર્ગેટને ઘટાડી દેવાની 👖 ફરજ પડી હતી. ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે સતત બીજી મેચમાં | નિર્ણય લેવાની ફરજ પડી હતી. છઠ્ઠી જાન્યુઆરીના દિવસે વેલિંગ્ટન ખાતે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે પાકિસ્તાન પર ૬૧ રને 📘 જીત મેળવી હતી. પાંચ વનડે મેચોની શ્રેણી બાદ ત્રણ ટ્વેન્ટી મેચોની 📘

### મેથાણ ગામે છોકરીના અપહરણના મુદ્દે યુવાન પર હુમલો કરાયો

શ્રેણીની પ્રથમ ટ્વેન્ટી મેચ ૨૨મી જાન્યુઆરીથી રમાશે. પાકિસ્તાનની 📕

ટીમના તમામ બેટ્સમેનો હાલમાં ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા છે.

ટીમમાં ધરખમ ફેરફારો કરવાની જરૂરીયાત દેખાઇ રહી છે. ગુપ્ટિલ

છોકરીના અપહરણના મુદે લીમખેડા તાલુકાના મેથાણ ગામે થયેલ ઝઘડામાં એક ઈસમને ગડદાપાટનો ગેબી માર મારી તથા જાનથી મારી નાંખવાની ધાકધમકી આપ્યાનું જાણવા મળેલ છે.

હાલમાં જોરદાર ફોર્મમાં છે.

પ્રાપ્ત વિગત અનુસાર મેથાણ ગામના પારસીંગભાઈ ચતુરભાઈ ડામોરને પંચમહાલ જીલ્લાના મોરવા તાલુકાના વંદેલી ગામના નાવલસીંહ હીમસીંહ સંગાડા, સોનાભાઈ વીરસીંગભાઈ સંગાડા, શંકરભાઈ વીરસીગભાઈ સંગાડા તથા મગનભાઈ નારસીંગભાઈ સંગાડાએ એકદમ ઉશકેરાઈ બેફામ

બિભત્સ ગાળો બોલી તારા ભાઈનો છોકરી મારી છોકરીને ઉપલેટાથી લઈ ગયેલ છે. જે બાબતે પછપરછ કરવાની છે.' તેમ કહી પારસીંગભાઈ ડામોરને ગડદાપાટુનો માર માર મારી ગેબી ઈજાઓ પહોચાડી હતી. અને જાનથી મારી નાંખવાની ધાકધમકી આપી હતી. આ સંદર્ભે મેથાણગામના પારસીંગભાઈ ચતુરભાઈ ડામોરે રંધીકપુર પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઈપીકો **કલમ उ२**उ,५०४,५०६ (२) ૧૧૪ મુજબ મારામારીનો ગુનો નોંધી આંગળ કાર્યવાહી હાથ ધેરી

#### ગોલ્ડન બ્રીજને સમાંતર બની રહેલ બ્રીજની કામગીરી દરમ્યાન કેઈને પલ્ટી ખાધી



ભરૂચ, ભરૂચ અંકલેશ્વર વચ્ચેના નર્મા નદી પરના ગોલ્ડન બ્રીજની સમાંતર બની રહેલ બ્રીજની કામગીરી દરમ્યાન એક ક્રેઈન પલ્ટી ખાઈ જતા દોડધામ મચી જવા પામી હતી જોકે સદ્દનસીબે કોઈ જાનહાની થવા પામી ન

ગોલ્ડન બ્રીજના દક્ષિણ છેડા પર નવા બ્રીજની કામગીરી ચાલી રહી છે તે દરમ્યાન અચાનક એક

મહાકાય ક્રેઈને કોઈક કારણોસર સંતુલન ગુમાવતા રોડ પર ધડાકા સાથે પડી હતી જેથી ત્યાંથી પસાર થતા વાહનચાલકો સહિત આસપાસના લોકો પણ ગભરાહટથી દોડી આવ્યા હતા.

સદનસીબે વાહન વ્યવહારથી ધમધમતા આ રોડ પર કોઈ જાનહાની ન થતા પોલીસ કાફલાએ દોડી આવી ક્રેઈનને રોડ પરથી હટાવી વાહન વ્યવહારને પૂર્વવત કર્યો હતો. 🛨

### રોજગારીની તકો ઉભી કરવા પર બજેટમાં ખાસ ધ્યાન હશે

કેન્દ્રિય નાશાંપ્રધાન અરૂશ જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે સામાન્ય બજેટ રજૂ કરનાર છે ત્યારે બજેટમાં ક્યા ક્યા પગલા લેવામાં આવનાર છે તેના પર તમામનુ ધ્યાન કેન્દ્રિત થઇ ગયુ છે. બર્જેટમાં રોજગારીની વધુ તકુ ઉભી કરવાના મામલે મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે બજેટ ઐતિહાસિક સાબિત થાય તેવી શક્યતા છે. બજેટમાં જવાનો, યુવાનો, ખેડુતો અને કર્મચારીઓ પર ખાસ ધ્યાન આપવામાં આવનાર છે. નરેન્દ્ર મોદી સરકારે બજેટને લોકલક્ષી બનાવવા માટે તૈયારી કરી છે.નિષ્ણાંતો કહી

લોકોની તકલીફને ઓછી કરવા અને વધારે રાહત આપવા માટે બજેટમાં ઇન્ડસ્ટ્રીઝ અને ખેડુતો પર ખાસ ધ્યાન આપવામાં આવનાર છે. તેમની અપેક્ષાને પૂર્ણ કરવા માટે જુદા જુદા સેક્ટરોના પ્રતિનિધીઓ ર્પોત પોતાની રજૂઆત કરી ચુક્યા છે. અગાઉ ક્યારેય નહી લેવામાં આવેલા પગલા હવે લેવાઇ રહ્યા છે. ગરીબ વર્ગને વધારે પ્રાથમિકતા બજેટમાં આપવામાં આવનાર છે. એક વર્ષમાં જન ધન યોજના હેઠળ રેકોર્ડ ૧૭ કરોડ બેંક ખાતાઓ ખોલી દેવામાં આવ્યા છે. ૧૨ કરોડ લોકોને ૧૨ રૂપિયાની ચુકવણી કરીને અકસ્માત માટે વીમા હેઠળ જોડી દેવામાં આવ્યા છે. ટેક્સ ટાઇલ, એન્જિનિયરિંગ, મેન્યુફેકચરિંગ,

પ્રોસેસિંગ. પંપ મોટર્સ સહિતના ક્ષેત્રો દ્વારા તેમની રજૂઆત કરવામાં આવી ચુકી છે. સરકાર બજેટમાં મુખ્યરીતે સુધારા પર ધ્યાન કેન્દ્રિત કર્નાર છે. એલપીજી સબસિડી છોડી દેવા પર પણ ધ્યાન આપવામાં આવે તેવી શક્યતા છે. દેશમાં સામાન્ય લોકો બજેટને લઇને ઉત્સુકત છે. સાથે સાથે સરકાર સામે કેટલીક તકલીફ પણ છે. મોદી સરકાર તેની વર્તમાન અવધિમાં અંતિમ ફુલ બજેટ રજૂ કરવા જઇ રહી છે. આવી સ્થિતીમાં બજેટમાં ખાસ ધ્યાન રોજગારી પર આપવામાં આવનાર છે. હાલમાં ગુજરાતમાં ઓછા માર્જિન સાથે જીત્ થયા બાદ મોદી સરકાર રોજગારીને લઇને સાવધાન છે.

### દિલ્હી એરપોર્ટમાં દિનમાં ૧૩૦૦ ફ્લાઇટ મુવમેન્ટ

ભારતભરમાં કોઇ પણ

દિલ્હી વિમાનીથકે વધુ એક સિદ્ધી હાંસલ કરી લીધી છે. કારણ કે તે હવે સૌથી વધારે વ્યસ્ત એરપોર્ટ

પૈકી એક છે. દિલ્હીમાં ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનીથક પર વધતા એર ટ્રાફિકે હવે એક નવો રેકોર્ડ બનાવી લીધો છે. છેલ્લા દિવસોમાં અહીંથી ફ્લાઇટ મુવમેન્ટ સૌથી વધારે થઇ હોવાના હેવાલ મળ્યા છે. તે હવે વિશ્વના સૌથી વ્યસ્ત રહેતા લંડનના હિથ્રો વિમાનીમથકને પછડાટ આપી દેવામાં સફળ છે.ભારતમાં કોઇ પણ વિમાનીમથક કરતા દિલ્હીમાં સૌથી વધારે વિમાનો પહોંચી રહ્યા છે. દિલ્હી એરપોર્ટ પરથી એક

વિમાનીમથક કરતા સૌથી વધારે વિમાન દિલ્હી એરપોર્ટ પરથી મુવમેન્ટ થાય છે : રિપોર્ટ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે લંડનના હિથ્રો વિમાનીમથક પર ૨૪ કલાકમાં મહત્તમ ૧૩૦૦ ફ્લાઇટના મુવમેન્ટ થાય છે. જેમાં ઉડાણ ભરનાર અને ઉતરાણ

કરનાર વિમાનોનો સમાવેશ થાય છે.

થોડાક દિવસ પહેલા જ દિલ્હીના

વિમાનીમથકે સ્થાનિક અને

આંતરરાષ્ટ્રીય ટર્મિનલથી ફ્લાઇટ

મુવમેન્ટ ૧૩૦૦થી પણ વધારે

પહોંચી જતા આ નવો રેકોર્ડ સર્જાયો છે. જો કે આવી સ્થિતી વધારે દિવસ સુધી રહી ન હતી. અધિકારીએ એમ પણ કહ્યુ છે કે વર્તમાન સમયમાં દિલ્હી એરપોર્ટ પર એટલી જગ્યા હવે રહી ગઇ નથી કે વધારે ફ્લાઇટ મુવમેન્ટને સહન કરી શકે. અહીં એક કલાકમાં મહત્તમ ૭૩ ફ્લાઇટ મુવમેન્ટ કરાવી શકાય છે. કેટલીક વંખત આ સંખ્યા ૭૩થી ઉપર પહોંચી જાય છે. એર ટ્રાફિકના વધતા દબાણના કારણે દિલ્હી વિમાનીમથક હવે હિથ્રો કરતા પણ વધારે આગળ છે. જો કે અધિકારીએ કહ્યુ છે કે વર્લ્ડના ટોપ ૧૦ સૌથી વધારે વ્યસ્ત એરપોર્ટની યાદીમાં સામેલ થવામાં તેને સમય લાગી શકે છે.

### વાસદ ખાતે મહી બીજ ઉત્સવ ઉજવાચો

ગ્વાલલબાલાએ વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણ ના બાલ્યકાળમાં સખાની ભૂમિકા અદા કરી હતી. આજનો ગોપાલક સમાજ પણ કદાચ તેમની જ પરિપાટી જાળવી રહયો છે. પશુપાલનના વ્યવસાયને લીધે કુદરત સાથે નીકટનો નાતો ધરાવતો વિશાળ રબારી સમુદાય ગોપાલક સમાજનો જ એક અભિન્ન હિસ્સો છે. તેમની જીવનશૈલી તેમજ રીતરિવાજોમાં કૃતિના પૂજનની પરંપરા જીવંત છે. આ પરંપરાના

પાલનરૂપે મહાસુદ બીજને રબારીઓ તેમજ ગોપાલકો મહી બીજ તરીકે ઉજવે છે, તેના અવસરે આજે આણંદ જિલ્લાના વાસદ મહીસાગર માતાજીના મંદિર, વ્હેરાખાડી તેમજ વડોદરા જિલ્લાના ફાજલપુર ખાતે મહીસાગર માતાજીના મંદિરે રબારીઓ સહિત ગોપાલક જાતિઓના લોકોએ ઘણી મોટી સંખ્યામાં, પરંપરાગત વેશભૂષા, આભૂષણોમાં અને નવા જમાનાની યુવા પેઢીએ આધુનિક પરિવેશમાં લોકમાતા મહીસાગરનો ભક્તિ ભાવપૂર્વક ખોળો ખૂંદયો હતો. મહીસાગર માતાના દૂગ્ધાભિષેક, પવિત્ર સ્નાન અને દર્શન માટે ઉત્તર ગુજરાતથી લઈને ચરોતર અને દક્ષિણ ગુજરાતમાંથી રબારી બંધુઓ સપરિવાર મહીના કાંઠે ઉમટી પડ્યા હતા.

રબારી સમાજ દ્વારા મહી બીજની ઉજવણી પાછળ એક રોચક આસ્થા કથા વણાયેલી છે. આ પરંપરા ઘણા જુના સમયથી ચાલતી આવતી હશે તેમ મનાય છે. આ કથા પ્રમાણે લોકમાતા મહીના જ્યારે સાગર સાથે લગ્ન યોજાયા ત્યારે ગોપાલક સમાજના વ્યક્તિએ ચોથા મંગળફેરાએ



કન્યાદાન કર્યું હતું. આણંદ જિલ્લાના મહી અને સાગરના સંગમ બિંદુ જેવા વહેરા ખાડી ગામે આ લગ્ન યોજાયા હતા, તેવી પ્રખર લોકશ્રદ્ધા પ્રવર્તમાન છે. આમ રબારી સહિત ગોપાલક સમાજનો વિશાળ વર્ગ લોકમાતા મહીને કુળવર્ધીની માતા તરીકે લાકમાતાના કન્યાદાનન યાદ કરીને મહી બીજના દિવસે ગામે ગામથી રબારી સમાજ કુટુંબ કબીલા સાથે મહીસાગર માતાના ખોળે ઉમટી પડે છે. ઘરની ગાયનું દૂધ કેનમાં ભરીને લાવે છે. તેના દ્વારા મહીસાગરના જળનો અભિષેક કરે છે. પવિત્ર સ્નાન કરે છે. પ્રસાદરૂપે ખાલી કેનમાં મહીમાતાનું પાવન જળ ભરે છે. વાસદના નદી કાંઠે આવેલા મહીસાગર માતાના મંદિરે દર્શન-પૂજન કરે છે. યજ્ઞ પણ યોજાય છે અને મંદિરે ઉપવાસીઓને ફળાહાર કરાવવામાં આવે છે. કૃતિની ભક્તિનું અપૂર્વ શ્રદ્ધાભર્યું

#### વાતાવરણ જોવા મળે છે. ઘેર જઇને પ્રસાદરૂપે સાથે લાવવામાં આવેલા મહીજળનો બામણા આટર્સ એન્ડ કોમર્સ કોલેજ બની રહ્યો છે. એન. એસ. એસ. યુનિટ ધ્વારા મોંધરી ગામમાં સ્વચ્છતા જાગૃતિ શિબિર ચોજાઈ દરમ્યાન સમાજને પડકારતા ચોજાચો ભિલોડા,

બામણા-પુનાસણ મધ્યસ્થ સ્કુલ કેળવણી મંડળ મુંબઈ સંચાલિત સ્વ.એસ.એચ.જોષી,બી.કે.જોષી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ એન.એસ.એસ.યુનિટ ધ્વારા મોંધરી ગામમાં સ્વચ્છતા જાગૃતિ શિબિર યોજાઈ હતી.મોંધરી ગામમાં સ્વચ્છતા જાગૃતિ શિબિર દરમ્યાન ગામ સફાઈ,મફત આંખ નિદાન, રક્તદાન કેમ્પ,દુધ ઉત્પાદન અને પશુપાલન, પશુ ચિકિત્સા, આયુર્વેદિક આરોગ્ય તપાસ જેવા બૌધ્ધિક કાર્યક્રમો તેમજ રાત્રી

કુરિવાજોને નાથવા સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે ભૃણ હત્યા,બેરોજગારી,દહેજપ્રથા સહિત વિવિધ નાટકો વિદ્યાર્થીઓ ધ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.મોંધરી ગામમાં સાત દિવસીય સ્વચ્છતા શિબિરનું સફળ સંચાલન એન.એસ.એસ. પ્રો.ઓ.નિવૃત્તિનાથ આર. જોષી,પ્રો.ભીખાભાઈ પટેલ, પ્રિ.ર્ડા.કલ્પનાબેન પટેલ, શૈક્ષણિક, બિન શૈક્ષણિક સ્ટાફ ધ્વારા કરાયું હતું. મોંધરી ગામમાં આનંદની લાગણી પ્રસરી હતી. ★

#### ભિલોડા આર.જે.તન્ના પ્રેરણા વિદ્યા મંદીરમાં વ્યવસાયિક માર્ગદર્શન શિબિર ચોજાઈ

ભિલોડા, ભિલોડા આર.જે.તન્ના પ્રેરણા વિદ્યા મંદીરમાં વ્યવસાયિક માર્ગદર્શન શિબિર યોજાઈ.આર.જે. તન્ના પ્રેરણા મંદીરમાં ધોરણ.૧૦ અને ધોરણ.૧૨ ના વિદ્યાર્થીઓ માટે વડા પ્રધાન, મુખ્યમંત્રીને સ્કીલ ઈન્ડીયા અંતર્ગત વોકેશનલ ટ્રેનિંગ મહત્વ સમજે તે બાબત પર શિબિરમાં ખાસ ભાર મુંકાયો હતો.ભિલોડા આઈ.ટી.આઈ.ના જયેશભાઈ ભાવસારએ સરકાર

ध्वारा यासता विविध वोडेशनस

ટ્રેનિંગના ટ્રેડ વિશે વિસ્તૃત માહિતી

આપી હતી.બહેનો માટે ઉપયોગી કોર્સ અંગે વિશેષ ચર્ચા કરાઈ હતી.આચાર્ય રમણભાઈ પટેલએ વિદ્યાર્થીઓને સ્કીલ ઈન્ડીયા ડેવલોપમેન્ટ વિષય ઉપર વિશેષ ભાર મુંકી જુદા-જુદા જેવા કે સ્કીલ ડેવલોપમેન્ટ,મેઈક ઈન્ડીયા, સ્ટાર્ટઅપ ઈન્ડીયા, સ્ટેન્ડઅપ ઈન્ડીયા, ડીઝીટલ ઈન્ડીયા માટેના સ્વપ્નો સાકાર થાય તેવા ભગીરથ પ્રયત્નો કરવા જણાવાયું હતું.કાર્યક્રમનું સંચાલન શાળામાં કેરીયર કોર્નર ચલાવતા શિક્ષક કાંતીલાલ ભુધરાએ કર્યું હતું. 🛨

રબારી સમાજના લોકો બહુધા મહી બીજના દિવસે ઘરની ગાયના દૂધનું વેચાણ કરતાં નથી. સાંજના ઘરના દૂધની ખીર અને સુખડી બનાવે છે. સહુ ભક્તિ ભાવપૂર્વક સંધ્યાકાળે પૂજે છે. ગોપાલક દ્વારા બીજના ચંદ્રમાના દેર્શન કરે છે. તે પછી મહીસાગર માતાને ખીર અને સુખડીનો નૈવેધ ધરાવીને મહાપ્રસાદ ગ્રહણ કરે છે. આમ કૃતિ માતાના ગૌરવનો આ ઉત્સવ તેમના ભાતીગળ જીવન સાથે વણાઇ ગયો છે. રબારી લોકો શક્ત્રિ ઉપાસક છે. તેઓ ભગવાન શિવને પરમ પિતા અને મા શક્તિને માતા માને છે. જુના જમાનામાં રાજવીઓ ખાનગી સંદેશાઓ પહોંચાડવાનું કામ વિશ્વાસ રાખીને તેમને સોંપતા. બહેન-દીકરીઓના વળાવીયા તરીકે પણ તેમની સેવા લેવાતી. આધુનિક પ્રવાહોની અસર છતાં હજું આ સમાજની રહેણીકરણી તેમજ સમાજ જીવન પર પરંપરાનો ભાવ સચવાયો છે. જેની પ્રતીતિ મહી બીજની શ્રદ્ધાસભર ઉજવણીથી થાય છે. મહીસાગર કાંઠે મહા બીજનો આ પાવન અવસર અસંખ્ય શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બિન્દુ

સહુનું કલ્યાણ અને રક્ષણ કરે તેવી

ભાવના તેની પાછળ કામ કરે છે.

### ખેડબ્રહ્મા કોલેજમાં સપ્તધારા- કાર્યક્રમ

ખેડબ્રહ્મા,

ડી.ડી.ઠાકર આર્ટ્સ અને કે.જે. પટેલુ કોમર્સ કોલેજ ખૈડબ્રહ્મા ખાતે સ્વર્ણિમ ગુજરાત વૈશ્વિક ગુજરાત ઉત્ક્રષ્ટતા અભિયાન સપ્તધારા અંતર્ગત શે. વર્ષ ૨૦૧૭-૧૮ના સત્રાની તા.૧૯.૧.૨૦૧૮ના શુક્રવારના રોજ યોજાઈ ગઈ. જેમાં જુદી જુદી ધારાઓ જેવી કે નાટયધારા, કલા કોશલ્ય ધારા સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા, ખેલકુદ ધારા દ્વારા જુદી- જુદી ધારાઓની સ્પર્ધા રાખવામાં આવેલ. જેમાં પ્રથમ, બીજો અને ત્રીજા નંબર લાવનારને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના આચાર્યશ્રી એન.ડી.પટેલ તથા સપ્તધારાના કો.ઓર્ડીનેટરશ્રી ડો. વી.સી. નિનામા તેમજ વિવિધ ધારાઓના કન્વીનરીઓ દ્વારા કરવામાં આવ્યું. જેમાં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 🛨

#### લેસ્ટર્ને ટાઇક્સ

વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત જાહેરાતો અંગે વાંચકોએ પોતાની રીતે ચકાસણી કરી નિર્ણય લેવો.

-અહેરખબર મેનેજર

Place : Himatnagar Date : 19-01-2018

## પેટલાદ : ગુનાઓમાં દારૂ ઘટ્યો, જુગાર વધ્યો

ગત વર્ષ કરતા દારૂના ગુનામાં ૪૩ ટકાનો ઘટાડો જુગારના ગુનામાં નોધપાત્ર ૩૯ ટકાનો વધારો

આશંદ જીલ્લામાં પેટલાદ એક વિભાગીય વડુ મથક છે. પેટલાદ વિભાગીય પોલિસ કચેરી

હેઠળ સાત પોલિસ મથકનો સમાવેશ થાય છે. જેમાં પેટલાદ ટાઉન, પેટલાદ રૂરલ, બોરસદ ટાઉન, બોરસદ રૂરેલ, મહેળાવ, ભાદરણ અને આંકલાવ પોલિસ મથકનો સમાવેશ થાય છે. જેની ડીવાયએસપી કચેરી પેટલાદ સ્થિત છે. આ સમગ્ર વિસ્તારમાં છેલ્લા છ વર્ષ દરમિયાન દેશી -વિદેશી દારૂના ૧૪૮૫૩ જેટલા ગુનાઓ પોલિસ દફતરે નોંધાયા છે. જ્યારે આ છ વર્ષમાં જૂગારધારાના ૭૫૩ ગુના નોંધાયા હોવાની વિગતો પ્રાપ્ત થાય છે. આ બન્ને ગુનાઓનું દુષણ નોંધપાત્ર રીતે વધઘટ થતુ જોવા મળ્યું છે. પરંતુ છેલ્લા બે વર્ષની આંકડાકીય માહિતી જોતા જાણવા મળે છે કે દારૂના ગુનામાં લગભગ ૪૩ ટકા જેટલો ઘટાડો થયો છે અને જુગારના ગુનાઓ આશરે ૩૯ ટકા જેટલા વધ્યા છે. અત્રે નોંધપાત્ર બાબત એ છે કે પેટલાદ અને બોરસદ તાલુકાની સરખામણીમાં આંકલાવ તાલુકો ખુબ નાનો હોવા છતા દારૂ અને જુંગારનું દુષણ સૌથી વધુ આ વિસ્તારમાં ફેલાયું હોવાનું જાણવા

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જીલ્લાનુ પેટલાંદ શહેર અતિસંવેદનશીલ અને બોરસદ સંવેદનશીલ શહેર ગણવામાં આવે છે. આ બન્ને તાલુકા મથકના શહેરોમાં દારૂ અને જુગારની બદી ફૂલીફાલી છે. તેમાય પેટલાદ શહેરમાં દેશી - વિદેશી દારૂ, જુગાર, વરલી મટકા, ચરસ જેવા કેંફી દ્રવ્યો ચાલતા હોવાનું જગજાહેર છે. ઉપરાંત ભૂતકાળમાં નકલી ચલણી નોટો, ચોરીના વાહનોની લે-વેચ સહિતના અનેક મોટા રેકેટ બહાર આવવા પામ્યા છે. પેટલાદ વિભાગીય મથક હેઠળના પેટલાદ અને બોરસદ શહેરમાં સમયાંતરે રાયોટિંગના ગુનાઓ પણ બનતા હોય છે. આવી અસમાજીક

છેલ્લા બે વર્ષ દરમિયાન દેશી-વિદેશી દારૂ જુગારધારા પોલિસ મથક 2095 5069 2095 5069 પેટલાદ ટાઉન ४२६ 308 34 પેટલાદ રૂચલ ४٥ξ ૧૯૯ બોરસદ ટાઉન ૫૨૦ 989 १८ ٩ξ બોરસદ રૂરલ २८४ ٩ξ3 १४ મહેળાવ **836** १८६ 09 06 ભાદરણ 808 ०४ ৭४ २८१ આંક્લાવ ૫૦૧ 359 १८ 3ξ

પ્રવૃતિઓ અને બેનંબરી વેપલાઓને કારણે પેટલાદ શહેર રોજગાર અને આર્થિક ક્ષેત્રે ઘશુ પાછળ ધકેલાઈ ગયું છે. આ વિભાગીય મથક હેઠળ સમાવિષ્ટ સાત પોલિસ મથકોનાં દફતરે નોંધાયેલ દારૂ અને જુગારના આંકડા ઉપર નજર ફેરવીએ તો ઘણી ચોકાવનારી વિગતો જોવા મળે છે. છેલ્લા છ વર્ષ દરમિયાન

દેશી - વિદેશી દારૂના ૧૪૮૫૩

જેટલા ગુનાઓ આ સાત પોલિસ

મથકોએ નોંધાયા છે. જેમાં વર્ષ ૨૦૧૨માં ૨૨૫૪, વર્ષ ૨૦૧૩ -૨૩૭૨, વર્ષ ૨૦૧૪ - ૨૯૬૯, વર્ષ ૨૦૧૫ - ૨૭૭૭, વર્ષ ૨૯૧૬ -૨૮૫૭ અને વર્ષ ૨૦૧૭માં ૧૬૨૪ ગુનાઓનો સમાવેશ થાય છે. આ આંકડા જોતા સ્પષ્ટ જણાય છે કે વર્ષ ૨૦૧૨ કરતા ૨૦૧૩માં પાંચ ટકા ગુના વધ્યાં છે. પરંતુ ૨૦૧૩ કરતા ૨૦૧૪માં પચ્ચીસ ટકાનો જંગી વધારો દેશી - વિદેશી દારૂના ગુનાઓમાં થયો હોવાનું જાણવા મળે છે. ત્યારબાદના વર્ષોમાં સામાન્ય ઘટાડો અને વધારો જોવા મળે છે. પરંતુ ગત કેટલાક મહિનાઓથી દેશી - વિદેશી દારૂ વેચનારાઓ સામે ખુદ પ્રજાએ લાલ આંખ કરી છે. જેથી સમગ્ર રાજ્યમાં ઠેરઠેર જનતા રેડ ચાલુ થઈગઈ છે. તેમાય ખાસ કરીને મહિલાઓ વિશેષ પ્રમાણમાં આ મુદ્દે સરકાર અને પોલિસની સામે આવી ગયા હોવાની ઘટનાઓ પણ જોવા મળી છે. જેથી સરકારે પણ દારૂના ગુનાઓના કાયદામાં સુધારા કેરી કડક અમલીકરણ શરૂ કર્યું છે. જેને કારણે પેટલાદ વિભાગીય પોલિસ મથક હેઠળ વર્ષ ૨૦૧૬ કરતા વર્ષ ૨૦૧૭માં દેશી - વિદેશી દારૂના

ગુનાઓમાં ૪૩ ટકા જેટલો ર્નોધપાત્ર ઘટાડો થયો છે. દારૂના ગુનાઓની સાથે આજની પેઢીના યુવાનો જુગાર અને સક્રાબેટીંગના રવાડે ચઢી જતા જોવા મળે છે. પેટલાદ વિભાગના સાત પોલિસ મથક હેઠળ છેલ્લા છ વર્ષ દરમિયાન જુગારધારાના ૭૫૩ જેટલા ગુનાઓ નોંધાયા છે. જેમા વર્ષ ૨૦૧૨માં ૧૨૭, વર્ષ ૨૦૧૩ - ૧૪૪, વર્ષ ૨૦૧૪ -૧૨૯, વર્ષ ૨૦૧૫ - ૧૦૨, વર્ષ ૨૦૧૬ - ૧૦૫ અને વર્ષ ૨૦૧૭માં - ૧૪૬ ગુનાઓ નોધાયાનો સમાવેશ થાય છે. જુગારધારાના ગુનાઓની આંકડાકીય માહિતી જોતા સ્પષ્ટ થાય છે કે વર્ષ ૨૦૧૨ કરતા વર્ષ ૨૦૧૩માં ૧૩ ટકા વધારો થયો છે. પરંતુ ત્યારબાદ સતત બે વર્ષ સુધી આ પ્રકારના ગુનાઓમાં અનુક્રમે ૧૦ ટકા અને ૨૧ ટકાનો ઘટાડો થયો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૫ કરતા વર્ષ ૨૦૧૬માં માત્ર ત્રણ ટકાનો વધારો થયો હતો. પરંતુ વર્ષ ૨૦૧૬ કરતા વર્ષ ૨૦૧૭માં જુગારધારાના ગુનાઓનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી જતા ૩૯ ટકાનો વધારો જોવા મળે છે.

પેટલાદ વિભાગ હેઠળના સાત પોલિસ મથકો પૈકી આંકલાવ પોલિસ મથક હેઠળ દારૂ અને જુગારધારાના ગુનાઓ સૌથી વધુ નોંધાયા હોંવાની ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે.

સંકલન : વિનાચક આણંદજીવાળા

#### રાબડાળ ગામનો યુવક ગુમ

ઉત્તરાયણના દિવસે વહેલી પરોઢે કોઈપણ કારણસર કોઈને કહ્યા વગર ઘરેથી કયાંક જતા રહેલા રાબડાળગામના ૩૪ વર્ષીય પરણીત યુવકની આજદીન સુધી કોઈ ભાળ ન મળતાં પોલીસમાં આ અંગેની જાણ કર્યાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર રાબડાલ ગામના ગાયુત્રી મંદીરની પાસે રહેતા ૩૪ વર્ષીય દલુભાઈ ખીમાભાઈ વહોનીયા ગત તા.૧૪-૧-૨૦૧૭ને ઉત્તરાયણના રોજ વહેલી પરોઢના પાંચેક વાગ્યાના સુમારે કોઈ કારણસર ઘરેથી કોઈને કાંઈ કહ્યા વગર નીકળી કયાંક જતા રહયા હતા. દલુભાઈ વહોનીયા મોડી સાંજ સુધી પરત ઘરે ન આવતાં ચિંતિત બનેલ તેમની પત્ની ચંપાબેને આસપાસ તેમજ સગેવહાલે તપાસ કરવા છતાં દલુભાઈને કોઈ ભાળ મળી ન હતી. જેથી ગુમ સુદા દલુભાઈ વહોનીયાની પત્ની ચંપાબેન દલુભાઈ વહોનીયાએ પત્ની ચંપાબેન દલુભાઈ વહોનીયાએ આ સંબંધે દાહોદ તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસે આ સંદર્ભે ગુમસુદા અંગેની જાણવાજોગ નોધી આગળ તપાસ હાથ ધરી છે. ★

વધારો થયો છે. અમદાવાદ,

ભારતમાં આર્થિક વૃદ્ધિ વેગ પકડશેઃ સમ્પથ

બજાજ આલયાન્ઝ લાઇફ ઇન્સ્યોરન્સનાં ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર સમ્પથ રેડ્ડીને ભારતમાં કોર્પોરેટ આવકનાં ચક્રમાં સુધારા સાથે આર્થિક વૃદ્ધિ વધવાની અપેક્ષા છે, જે મધ્યમથી લાંબા ગાળે બજારો માટે લાભદાયક રહેશે. તેમણે કહ્યું હતું કે, લાંબા ગાળે

જ્ઞરનાં વળતર જીડીપી વૃદ્ધિ સૌથી વધુ આગેક્રચ છે. અને કોર્પોરેટ આવકમાં વૃદ્ધિ જોવા મળશે અને એટલે રોકાણકારોએ ઇક્વિટીની ચક્રવૃદ્ધિ અસર મારફતે સંપત્તિનું સર્જન કરવા શિસ્તબદ્ધ રીતે

રોકાણ કરવું જોઈએ. સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડમાંથી સંસ્થાગત રોકાંશનાં ઊંચા પ્રવાહ તાજેતરમાં ફોરેન ઇન્વે સ્ટર પોર્ટફોલિયો (એફપીઆઇ)માં વધારો થવાથી ઇક્વિટી બજારો માટે વર્ષ ૨૦૧૭ સારું પુરવાર થયું હતું. રોકાણકારો તેમનું તબક્કાવાર રીતે તેમનું રોકાણ પરંપરાગત ફિઝિકલ એસેટ્સમાંથી નાણાકીય એસેટ્સમાં તબક્કાવાર ખસેડી રહ્યાં છે તથા ખાસ કરીને ડિમોનેટાઇઝેશન પછી તેમાં

રેક્રી, બજાજ આલચાન્ઝ લાઇફ ઇન્સ્ચોરન્સ

સરકારનાં કેટલાંક સુધારાનાં લાભ મળવાનું શરૂ થયું છે, જેમ કે વિશ્વ બેંકની વેપારવાણિજ્યમાં સરળતા લાવવાની યાદીમાં ભારતે ૩૦ ક્રમની હરણફાળ ભરી છે અને ચાલુ વર્ષે તેનું સ્થાન ૧૩૦થી સુધરીને ૧૦૦ થયું છે, જે ચાલુ વર્ષની યાદીમાં કોઈ પણ દેશની

કોર્પોરેટ આવકમાં સુધારો અને આર્થિક વૃદ્ધિમાં સુધારો એ બંને મુખ્ય પરિંબળો છે, જે ચાલુ વર્ષે બજારો્ને અસર કર્શે. ભારતમાં કોર્પોરેટ આવકોમાં વધારાની શ૩આત થઈ છે. તેમને નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮નાં બીજા અર્ધવાર્ષિક ગાળામાં આવકમાં વધારો થવાની અપેક્ષા છે અને નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં અર્થસભર રીતે વધારો થશે. બજારો કોર્પોરેટ આવકનો અનુસરે છે. ગયા વર્ષની સરખામણીમાં ભારતની આર્થિક વૃદ્ધિમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે અને શ્રી રેક્રીને ૨૦૧૮માં તબક્કાવાર રીતે વેગ પકડવાની અપેક્ષા છે, જે માટે ઉપભોગમાં વધારો અને રોકાણમાં તબક્કાવાર સુધારો જવાબદાર છે.

NALIN LEASE FINANCE LIMITED CIN: L65910GJ1990PLC014516

Regd.Off: Ground Floor, Gandhi Nursing Home Bldg., Dr.Nalinkant Gandhi Road, Himatnagar- 383 001. Gujarat India

**EXTRACT FROM THE STANDALONE UNAUDITED** FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31.12.2017

1. Total Income From Operations 2. Net Profit/(loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) 3. Net Profit/(loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items) 4. Net Profit/(loss) for the period after Tax(after Exceptional and/or Extraordinary items) 5. Total Comprehensive Income for the period (Comprising Profit /(Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after tax) 6. Paid up Equity Share Capital 7. Reserves (Excluding Revaluation Reserve) as shown in the auditing Balance Sheet of the previous year	Current Endir (31.12.2	ng Ending	Corresponding 3 months ended in the previous year (31.12.2016)
Net Profit/(loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)     Net Profit/(loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)      Net Profit/(loss) for the period after Tax(after Exceptional and/or Extraordinary items)      Total Comprehensive Income for the period (Comprising Profit /(Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after tax)     Paid up Equity Share Capital     Reserves (Excluding Revaluation Reserve) as shown in the auditing	dited Unaudite	ed Audited	Unaudited
(before Tax, Exceptional and/or Extraordinary items)  3. Net Profit/(loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)  4. Net Profit/(loss) for the period after Tax(after Exceptional and/or Extraordinary items)  5. Total Comprehensive Income for the period (Comprising Profit /(Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after tax)  6. Paid up Equity Share Capital  7. Reserves (Excluding Revaluation Reserve) as shown in the auditing	101.22	256.19	41.76
Tax (after Exceptional and/or Extraordinary items)  4. Net Profit/(loss) for the period after Tax(after Exceptional and/or Extraordinary items)  5. Total Comprehensive Income for th period (Comprising Profit /(Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after tax)  6. Paid up Equity Share Capital  7. Reserves (Excluding Revaluation Reserve) as shown in the auditing	52.98	136.60	12.98
Net Profit/(loss) for the period after Tax(after Exceptional and/or Extraordinary items)     Total Comprehensive Income for th period (Comprising Profit /(Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after tax)     Paid up Equity Share Capital     Reserves (Excluding Revaluation Reserve) as shown in the auditing	re 52.98	136.60	12.98
period (Comprising Profit /(Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after tax)  6. Paid up Equity Share Capital  7. Reserves (Excluding Revaluation Reserve) as shown in the auditing	52.98	92.65	12.98
7. Reserves (Excluding Revaluation Reserve) as shown in the auditing	I	92.65	12.98
Reserve) as shown in the auditing	326.20	326.20	326.20
	790.10	674.13	576.94
Earnings Per share (of Rs 10/- eac (for continuing and discontinuing operations)-     Basic:     Diluted:	h) 1.62 1.62		0.40 0.40

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Reguirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the BSE website (www.bseindia.com) &

> For, NALIN LEASE FINANCE LTD Sd/- **(D.N.Gandhi)** *Managing Director*

# **Susmess**

1st BFSI Summit by ASSOCHAM Gujarat Council with Theme: **INDIA GROWTH STORY – MARKETS, THEN & NOW!** 

Ahmedabad, ASSOCHAM, India's Apex Chamber of Commerce is organizing its first BFSI Summit on the theme "INDIA GROWTH STORY -MARKETS, THEN & NOW!" with an objective to obtain compendium of articles on Investment Avenues in financial Space and get insights from the key decision makers from across the industry, in a fast growing BFSI

The Summit was inaugurated by Shri. Saurabh Patel, Hon'ble Minister of Energy, Government of Gujarat As Chief Guest along with Ms. Bhagyesh Soneji, Chairperson – ASSOCHAM Gujarat Council and BFSI Committee, ASSOCHAM Gujarat Council Chairman Mr. Madhu Menon.

Ms. Bhagyesh Soneji, Chairperson ASSOCHAM Gujarat Council said that today's summit is a great learning opportunities for investors and announced the first of its kind BFSI Summit is considered to be one of the most awaited topics that will give an overview on the regulations & policy by the Central & State Government, Investment Avenues

Indian Railways is firm-

ing up a proposal to de-

theme park, a first-of-its-

kind in the country, at

Rewari, in cooperation with

the Union Tourism Ministry

and the Haryana govern-

The rail theme park, to be developed on the pat-

tern of UK's Devon Railway

Centre, would comprise of

narrow gauge toy train,

model train stations, railway

exhibits and a convention

centre to host corporate

events. Similar theme parks

exist in other countries, like

the Edaville Park in the US

and Ferrymead Heritage

Park in New Zealand. The rail

theme park will be part of

the development of the

Madhogarh-Mahendragarh

-Narnaul-Rewari heritage

route being developed by

the Tourism Ministry under

the Swadesh Darshan



in Financial Space, Insurance Solutions, Financial Planning & Wealth Management, Financing & Alternate Lend-

ing etc. Saurabhbhai Hon'ble Minister for Energy, encouraged ASSOCHAM team by selecting the right theme that is India Growth Story. He advised the audience to make the best use of the advise and guidance that will be given in the summit on their investment. He said that India's growth story has a very encouraging figures and comparing with other

"Since the Railways has

a heritage steam loco centre

at Rewari, the development

of a rail theme park on the

adjoining land can convert

the place into a tourist

hotspot," a senior Railway

cessible from the capital and

Gurgaon, can become a ma-

jor crowd-puller -- in the

process developing its local

economy and promoting

marked 8.8 hectares of land

adjoining Rewari steam loco

centre for the rail theme

park. The Rewari steam loco

centre has been recently

renovated with many tour-

ist facilities being provided

simulator where tourist can

enjoy the feel of driving a

Darjeeling Himalayan Rail-

way steam locomotive, a 3-

There is a steam loco

The Railways has ear-

tourism, he added.

for the purpose.

Rewari, being easily ac-

Ministry official told IANS.

countries India is at a pace of 6-7% which is very prom-

ising and encouraging.

Madhu Menon, Chairman, BFSI Committee, Gujarat Council briefed the audience on the overall programme flow of the summit and the take away from this Summit. He announced that how for the first time with technology like mobile app will help the audience to actively participate in the summit and connect with the speakers which will help them take wise decision on their investment front.

D virtual reality coach simu-

lator depicting evolution of passenger coaches over

time, a toy train, and a gar-den-scale model train sys-

tem to educate visitors

about various aspects of a

steam centre has an indoor

exhibition gallery, a 35-

seater projection room to

display videos and conduct

visitors' orientation, a cen-

tury-old dining car and a

caféteria with a souvenir

Besides, it is also on the itinerary of the steam-hauled tourist special train

which runs between Delhi Cantonment and Rewari ev-

ery second Saturday during

the Rewari centre ranges

between 250 and 450 a day,

primarily comprising do-

mestic and foreign tourists,

Currently the footfall at

ctober-April.

In addition, the Rewari

train's operation.

### Essar Shipping eyes 38% growth in cargo volume

ports, including Kandla, Mumbai, Vizag, Mangalore

and Paradip, as well as mi-

nor ports like Hazira, Okha,

Dighi, and Kattupali. Essar

Shipping has been moving

cargo through the coastal

shipping route since 1975.

dustries including steel, ce-ment, construction, miner-

als & metals, among others. The customers are a mix of

Essar group companies as

well as other companies

operating in these sectors.

ESL CEO said the company

has placed order for four

Supramax vessels (54,000

DWT each) whose delivery

is scheduled in 2020. Thé

company is also looking to

add a Pánamax vessel and

tanker to its fleet in the next

fiscal, which will increase its Dry Weight Tonnage (DWT) capacity from 1.63 million to 1.7 million. The plan is also to diversify its fleet,

The company serves in-

**Ahmedabad,** vessels berth at are almost pping Ltd (ESL) all the 12 major Indian

Essar Shipping Ltd (ESL) is eyeing a 38 per cent growth in cargo volume in the ongoing fiscal to 18 mil-lion tonnes (MT), a company official said. The company had handled 13.06 MT of cargo in the previous fis-

Essar Shipping CEO Ranjit Singh said the growth in volumes can be attributed to the increased coastal cargo movement undertaken by ESL.

"In April-September of 2017-18, the company s 14-vessel diversified fleet had already handled 7.72 MT of dry bulk cargo. The cargo handling volumes in October and November this year were 1.25 MT and 1.27 MT, respectively. Given the trend, ESL is expecting to clock 18 MT of dry cargo in 2017-18," he said. The company has a 20 per cent market share in coastal cargo along the Indian coast, Singh said. The 12 dry bulk carriers in ESL s fleet are engaged in coastal shipping as well as in overseas trade.

which comprises two Very Large Crude Carriers (VLČCs), to bring more balance between bulk and liquid cargo, he added. The ports that these

#### **HCL** Technologies net up 6%

New Delhi, Software major HCL Technologies Ltd on Friday reported Rs 2,194 crore consolidated net profit for the third quarter (Q3) of fiscal 2017-18, posting 6 per cent annual growth from Rs 2,070 crore in the same period year ago and flat (0.3 per cent) sequential from Rs

2,188 crore a quarter ago.

In a regulatory filing on the BSE, the Noida-based IT firm said consolidated revenue for the quarter under review (Q3) grew 8.4 per cent yearly to Rs 12,808, from Rs 11,814 crore in the like period year ago, and 3 per cent sequentially from Rs 12,434 crore a quarter ago.In dollar terms, net income, however, grew 11.2 per cent yearly to \$340 million for the quarter from \$306 million in the same period a year ago but flat (0.3 per cent sequentially from \$339 million in the like

ago.Consolidated revenue under the International Financial Reporting Standard (IFRS) grew 13.9 per cent yearly to \$1,988 million from \$1,745 million a year ago and 3 per cent sequentially from \$1,928 million a quar-

ter ago.

### Business Brief III

#### Audi India launches second generation Q5

New Delhi,

Luxury car manufacturer Audi India on Thursday launched the all-new second generation Audi Q5 priced at Rs 53.25 lakh onwards. According to the company, the new Q5 is powered by a 2.0 TDI engine with a total output of 140 KW (190 hp) with seven-speed S tronic transmission."With a lighter body, a whole new design language and a host of new infotainment and innovative features, the new Audi Q5 is the best offering in its segment available for our customers who want to enjoy driving whether it is on or off the road," said Rahil Ansari, Head, Audi

#### First round of bidding under OAL launched

New Delhi,

The central government on Thursday launched the first round of bidding under the "Open Acreage Licensing" (OAL) programme for international competitive bidding. For the first time in India, 55 bidder-selected blocks, each carved out by prospective bidders themselves in promising basins with an area of 59,282 sq.km., were announced for bidding," the Ministry of Petroleum & Natural Gas said in a statement. "This is the largest offering of acreages the government has announced in the past eight years.

#### Kotak Mahindra Bank logs 20 per cent growth in net profit

Private sector Kotak Mahindra Bank on Friday said it closed the guarter ended on December 31, 2017 with 20 per cent growth in its net profit over the corresponding period the previous fiscal.In a regulatory filing in BSE, the bank said that on a standalone basis it had posted a net profit of Rs 1,053.21 crore, up from Rs 879.76 crore logged during same period in 2016. The bank's total income for the period under review was Rs 6,049.02 crore, up from Rs 5,377.83 crore earned in Q3 of FY17.The bank's net interest income for the period under review was Rs 2,394 crore, up from Rs 2,050 crore in Q3

#### Jio committed to use Open Source technologies to better consumer experience

Reliance Jio is committed to contribute and use Open Source technologies to better its consumer experience, the company's Director and Board Member Akash Ambani said here on Friday.

"Open Source is very important for Jio - being both a contributor and utilising it for our business needs. Every day people when people use a LYF device, Jio Phone or Jio Application - their lives are enriched through the technologies enabled with Open source," Ambani said during his inaugural speech at the India Digital Open Summit.

#### Pakistan, Iran to restore passenger train service

Pakistan and Iran have decided to restore a fortnightly passenger train service between the two countries by September due to improvement in the security situation. A Joint Expert Committee meeting was held here on Thursday, Xinhua news agency reported. The train service will run between Pakistan's southwestern city of Quetta and the Iranian cities of Mashhad and Qom. The service will largely cater to the needs of pilgrims during Muharram, the first month of the Islamic calendar. The two sides also de-15 regular freignt trains between Quetta and Iran's Zahedan due to the demands of the business community. The Islamabad-Tehran-Istanbul train also came up for discussion at the meeting.

#### Baidu upgrades research institute to accelerate Al application

(Rs.in Lacs

Corresponding

3 months

ended in the

previous year

(31.12.2016)

Unaudited

41.76

12.98

12.98

12.98

12.98

326.20

576.94

0.40

Chinese Artificial Intelligence (AI) giant Baidu has upgraded its research institute to speed up industrial application of AI technology. Baidu Research announced on Friday that it has set up two more labs focusing on business intelligence, robotics and autonomous driving while bringing three more top Al scientists on board. The company's top AI research platform now has five labs and seven globally renowned AI scientists, reports Xinhua news agency. The expansion of Baidu Research is the start of a new journey for Baidu to focus on frontier fundamental research and commercial application of Al," Wang Haifeng, Head of the Institute and Baidu Vice President, was quoted as saying.

Year to Date

Figures/

Previous Year

Ending

(31.03.2017)

Audited

256.19

136.60

92.65

92.65

326.20

674.13

2.84

NALIN LEASE FINANCE LIMITED

CIN: L65910GJ1990PLC014516

Regd.Off: Ground Floor, Gandhi Nursing Home Bldg., Dr.Nalinkant Gandhi Road,

Himatnagar- 383 001.Gujarat India

Phone: 02772-241264, 242264, email: nalinlease@yahoo.co.in www.nalinfin.co.in

Quarter

Ending/

**Current Year** 

**Ending** 

(31.12.2017)

Unaudited

101.22

52.98

52.98

326.20

790.10

1.62

EXTRACT FROM THE STANDALONE UNAUDITED

FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31.12.2017

#### **Equity indices trade** Railway heritage theme at fresh highs led by banks stocks park on the anvil at Rewari

Key Indian equity indi-ces on Friday traded at fresh highs during the mid-afternoon session buoyed by broadly positive Asian indices, coupled with upbeat quarterly corporate earnings and healthy buying in banking stocks.

At 12.40 p.m., the wider Nifty50 of the National Stock Exchange traded higher by 19 points or 0.18 per cent at a fresh level of 10,836 points. On the BSE, the barometer 30-scrip Sensitive Index (Sensex), which opened at 35,339.11 points, traded at a new high of 35,368.51 points -- up 108.22 points or 0.31 per cent -- from its previous session's close. The Sensex has so far touched a high of 35,434.08 points and a low of 35,221.16 points intra-day

trade. However, the BSE market breadth was bearish as 1,663 stocks declined as compared to 1,030 ad-

### **Economic growth to** pick-up in India: Reddy

Ahmedabad,

Insurance's Chief Investment Officer Sampath Reddy expects economic growth to pick-up in India, accentuated with a revival in the corporate earnings cycle, which would augur well for the markets over the medium to long term.

Over the long term, market returns will reflect GDP growth and corporate earnings growth, and therefore investors should carry on investing in a disciplíned manner to build wealth through the compounding effect of equities, was his opinion.

2017 was a good year for equity markets, helped by record high institutional flows from domestic mutual funds, and also a recent pick-up in foreign portfolio investor (FPI) flows. Investors have also been gradually shifting from traditional physical assets to financial assets, and this has espe-

Local politics major roadblock for regional

trade, cooperation, says Ex ADB official

cially picked up pace post de-monetization. Some of the reforms of

the government have started bearing fruit, with India's ranking jumping by 30 places in World Bank's Ease of Doing Business 2018 rankings, from 130 in the previous year to 100 in this year—making it the biggest jump for any country in this year's rankings. Corporate earnings re-

vival and economic growth on recovery path are two of the major factors that will affect markets in this year. With corporate earnings being muted over the past few years, equity markets have been driven by PE expansion. Corporate earnings in India seem to have bottomed out. He expects earnings growth to pick up from 2HFY18 (second half of FY18), and that will drive markets, rather than PE expansion. The markets will be closely tracking this, as it has already priced in this revival.

### Sri Lanka, China to cobuild power plant

Colombo, Sri Lanka and China on

Friday signed a joint venture agreement to construct Sri Lanka's largest dendro power plant in the country's south. The power plant will produce 70,000 megawatts of renewable energy a year to the national power grid. The joint venture was signed between Beijing Full Dimension Power Tech Co Ltd, Nanjing Turbine and Electric Machinery Group Co Ltd and Sri Lanka's IMS Holdings, Xinhua news agency reported. Speaking at the ceremony, Jinawara Dharmawardana, Chairman of IMS Holdings, said dendro

power was the generation of electricity from sustainably grown biomass (fuel wood) and in this project the fuel would be produced from the wood of the Gliricidia Sepium tree.

Hundreds of farmers in drought-prone Moneragala district will benefit from this project as the farmers supplying Gliricidia Sepium wood will make \$3.2 million per year as a result of the power plant, Dharmawardana said.

Explaining the reasons for choosing Gliricidia Sepium wood as the fuel rather than solar power to run the turbines in the Dharmawardana said the

primary mission of the company was to financially secure the farmers in droughtprone areas of the island nation.Hu Xingzhong, chairman of the Beijing Full Dimension Power Tech Co Ltd, said the project was of "great significance" not only to the partners but also to the two countries.The power plant will consist of six biomass boilers and three steam turbine generators as the core of the power generation system.

#### Regional trade and cooperation between neighbouring countries is

adversely affected due to local politics, said Rajat Nag, economist and former Managing Director-General, Asian Development Bank,

"Issues are really political, not because of lack of knowledge...not because people don't know what the benefits are... but its local politics which are coming in the way," Nag said at a seminar here on "Cross border Energy Cooperation in the Bay of Bengal Region" organised by CUTS International.Regional cooperation in South Asia is very low despite great potential and goodwill, he said.

Trying to allay fears concerning cross-border trade due to security threats, he said, "more we get invested in each other...the security increases rather than decreases".Integrated na-

Epps, a native from New

York, will be replaced by the

other novice from the 2009

class, Serena Aunon-Chan-

cellor, who was serving as

Epps' backup for this mis-

ture of regional trade and cooperation should be built up in such a way that no one particular party would find it in its interest to disrupt the system, he added. Speaking about the people losing on land and property due to developmental projects, he said that, such people must be compensated adequately.

There are losers, and we need to honestly identify who they are and what dó we do about compen-

active Astronaut Corps at

the space center to assume

duties in the astronaut of-

fice. She will be considered

for assignment to future

**WESTERN TIMES** Disclaimer

sating them fairly," the

economist said."Just as-

suming that regional trade,

cooperation is good, is not

good enough. You will have

to show actually, how this

process will work," Nag

Adverstisement appeared in this News Paper have not been verified factually and "WESTERNTIMES" does not stand responsible for the sales proposition.

**PARTICULARS** 

Whether results are Audited or Unaudited

Total Income From Operations

Net Profit/(loss) for the period

Tax (after Exceptional and/or

Extraordinary items)

Extraordinary items)

(before Tax, Exceptional and/or

Net Profit/(loss) for the period before

Net Profit/(loss) for the period after Tax(after Exceptional and/or Extraordinary items)

Total Comprehensive Income for the

period (Comprising Profit /(Loss) for

Comprehensive Income (after tax)

Reserves (Excluding Revaluation

Reserve) as shown in the auditing

8. Earnings Per share (of Rs 10/- each)

(for continuing and discontinuing

Balance Sheet of the previous year

the period (after Tax) and Other

6. Paid up Equity Share Capital

operations)-

Basic:

Diluted

### **NASA cancels African-American** astronaut's first flight to space sion. According to NASA, the nauts from that class have sion. According to the already flown into space.

NASA's Jeanette Jo Epps, an astronaut and American aerospace engineer, will not be a part of the International Space Station (ISS) crew set to launch in June, the US space agency said. Epps, who would have been the first African-American crew member on board the ISS, was pulled from her mission for unspecified reasons. "A number of factors are considered when making flight assignments. However, these decisions are personnel matters for which NASA doesn't provide information," Brandi Dean,

Johnson Space Center was quoted telling as Arstechnica. Epps was a member of NASA's 20th class of astronauts, a group of nine known as the "Chumps" who were selected in June 2009. Only three other African American women have flown into space. Epps' assignment in January 2017 garnered a fair amount of favourable pub-

licity for the space agency. She had been assigned to her first spaceflight, Expedition 56/57, scheduled to launch in May 2018.

Seven of the nine astro-

02.02.2018, 18:00 hrs.

05.02.2018. 18:00 hrs.

D.A. DIPLOMA ENGINEERING & TECHNOLOGY

Ph.: 02694-244029 • M.: 91060 07376

	posts at above mentioned address.									
			Diploma							
	Branch	Degree			Principal - 1					
		Professor	Asso. Professor	Asst. Professor	H.O.D.					
	Mechanical	1	3	3	1					
	Civil	1	2	-	1					
	Computer	1	1	3	1					

Qualification and pay scale as per the norms from the AICTE, Government of Gujarat and G.T.U. Higher qualification and experience can be considered for higher salary. Send your application along with all educational self attested documents, 2 passport size photos, ID proof and copy of Pan card in 2 set through speed post, registered A.D only.

& M.E. or M. Tech As per norms Minimum qualification for degree is M.E or M.Tech (With first class),

Interview Place: VEDANT EDUCATION CAMPUS, Jaykrishna Society jaymala Cross Road, Isanpur, Ahmedabad. Candidates should appear with original documents Application form can be

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the BSE website (www.bseindia.com) 8

For, NALIN LEASE FINANCE LTD Place: Himatnagai Sd/- (D.N.Gandhi) Date: 19-01-2018 Managing Director

CHANGE OF NAME I have changed my old name from PATEL RAJESHKUMAR VITHALBHAI to New Name SAPARIYA RAJESHKUMAR VITHALBHAI

Add.: A/41, Deepkala Avenue, Bopal, Ahmedabad

CHANGE OF NAME I have changed my old name from SANGTANI RESHMA MANSUKHLAL to New Name AHUJA JIYA PAWAN Add.: M/502, Kailashraj Hights, Nr. Maya Cinema.

Kubernagar,

Ahmedabad-382340

KAMDHENU UNIVERSITY, GANDHINAGAR-382010 Karmyogi Bhavan, Block-1, 3rd Floor, Wing-B1, Sector-10A, Gandhinagar-382010 Phone No.: 07965722001

peripherals, etc.

EMD, Tender Fee etc. at Kamdhenu University office by RPAD, speed post, courier only 07.02.2018 Tentative opening date for technical and commercial bid

2 Last date of on-line submission

Last date for submission of

INF/2500/17-18

No./KU/D.R./U-2/e-Tender/TDN3-2017-18 Date: 19.01.2018 E-TENDER NOTICE - 03 OF 2017-18

Kamdhenu University, Gandhinagar invites tenders through e-procurement portal https://www.acd.nprocure.com for the procurement of Equipment / Scientific Instruments / Computer 1 Date of on-line Tender 22.01.2018

**Director of Research** 

Hiraba Kelavani Trust Managed
D.A. DEGREE ENGINEERING & TECHNOLOGY

missions.

Nr. Khatraj Chokadi, At. Mahemdabad-387130 Dist. Kheda. Gujarat. Faculty Recruitment Applications are invited within 07 days in prescribed format for following

Minimum qualification for diploma HOD is B.E or B.Tech (With first class

& Ph. D is must As Per Norms Interview Date: 04/02/2018 Sunday 09:00 am onwards

downloaded from our web site : www.dadet.in By Management